

JANA SMALL FINANCE BANK

(A Scheduled Commercial Bank)

SANCTION LETTER & KEY FACT STATEMENT OF JANA SB LOAN

જન લોન માટે મંજૂર પત્ર

પ્રતિ: _____

ગ્રાન્ટનું નામ:

રેકૃ

તારીખ:

ગેરન્ટર:

માનનીય સાહેબ/મેડમ,

આ પત્ર જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ સમક્ષ પ્રસ્તુત કરાયેલી તમારી લોન અરજી નં. _____ ("લોન અરજી")ના સંદર્ભમાં છે. લોન અરજીમાં તમે કરેલી રજૂઆતો તેમજ આપેલી ખાતરીઓના આધારે, અમે જોઈન્ટ લાયબિલિટી ગ્રુપના ધોરણે ("સુવિધા") અન્ય ગ્રુપ મેમ્બર્સની સાથે તમારી લોન અરજીને મંજૂરી આપતા ખૂબ આનંદ અનુભવીએ છીએ જે આ સાથે આર્દી બીડાપેલા પરિશિષ્ટ 1માં ઉલ્લેખિત કોમર્શિયલ શરતોને આધિન રહેશે. કૃપા કરીને આ મંજૂરીપત્રની સ્વીકૃતિ સાથે સુયોગ્ય સહી કરેલી નકલ અમોને સુપરત કરશો જે તમારી સ્વીકૃતિનો સંકેત આપશે જેથી ત્યારપછીની દસ્તાવેજીકરણની કાર્યવાહીમાં આગળ વધવામાં અમને સુગમતા રહે. આગળ, શરતોને આધિન રહીને વિતરણ કરવા માટે બેંક માટે દસ્તાવેજીકરણ પરિપૂર્ણ કરવું આવશ્યક છે. આપણા વ્યાપારી સંબંધોને જરી રાખવા અમે ઉન્નત છીએ.

આપનો આભાર.

જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ માટે અને વતી
અધિકૃત હસ્તાક્ષરકર્તા

પરિશિષ્ટ 1 (કોમર્શિયલ શરતો)

જાણવેનારનો URN: _____	ગ્રુપ લોન અરજી ક્રમાંક: _____	લોનનો ઉદ્દેશ: _____ અંતિમ વપરાશની પ્રવૃત્તિ: _____	CBS લોન એકાઉન્ટ નં: _____ જવાબદારી લોન એકાઉન્ટ નં: _____
ગ્રાન્ટનું નામ: _____ અમલીકરણની તારીખ અને સ્થળ: _____	જના ગ્રુપ: _____ લોનની પ્રકાર: _____	લોન સાર્વિકલ: _____ મુદત: _____	આઈડી પ્રકાર (કેવાયસી): _____ આઈડી ક્રમાંક (કેવાયસી): _____
લોન વિતરણની રકમ: રૂ. _____ જૂનું લોન એકાઉન્ટ નં: _____	વ્યાજદર: _____% વાર્ષિક (માસિક ધોરણે ઘટતી જતી બાકીના આધારે) પ્રકાર: _____	શિક્ષાત્મક ચાર્જિસ: ડિફોલ્ટના સંજોગોમાં, _____% પ્રતિ વર્ષ બાકી રકમ પર + GST	પ્રોસેસિંગ ફી અને પોર્ટફોલિયો કમિશન @ _____% લોન રકમ + GST 18% (મંજૂર કરાયેલી રકમ > ₹00000 હોય તો) : _____ (એકવાર ચૂકવણી)
દસ્તાવેજની ફી: _____ ફોરવોર્ડ/ આંશિક પ્રિ-પેમેન્ટ ચાર્જિસ: _____	પસંદ કરેલો વીમા: _____ વીમા ચાર્જિસ: _____ (2 વર્ષ માટે) (એકવાર ચૂકવણી)	વીમા કવર શરૂ થવાની તારીખ: _____ વીમા કવર પૂર્ણ થવાની તારીખ: _____ (પસંદ કરાય તો)	ગ્રાન્ટની લોન રકમ રૂ. _____ ચાર્જિસ અને રૂ. _____ જૂની લોનની બાકી બાદ કર્યા પછી; વિતરણની રકમ છે રૂ. _____
સુવિધાની સંપૂર્ણ મુદત દરમિયાન ચાર્જ કરાયેલું કુલ વ્યાજ છે: રૂ. _____ પરત ચૂકવવાપાત્ર કુલ રકમ: રૂ. _____	ઈએમઆઈ (ફિક્સ્ડ, રકમ અને સંખ્યા) ઈએમઆઈ: _____ ઈએમઆઈ રૂ. _____ ચૂકવવાપાત્ર છે _____ ધોરણે. પરત ચૂકવણી શરૂ થવાની તારીખ: _____ પરત ચૂકવણી પૂર્ણ થવાની તારીખ: _____ છેલ્લા હપ્તાની રકમ: _____	પરત ચૂકવણીનું માધ્યમ: કૃપા કરીને એકમાં ખર્ચ કરો અને વિગતો ભરો o NACH ડેબિટ ઈન્સ્ટ્રક્શન્સ o સ્ટેટિંગ ઈન્સ્ટ્રક્શન્સ o ચેક o યુપીઆઈ	અસરકારક વાર્ષિકીકૃત વ્યાજદર (96મો) (ગ્રાન્ટની વિતરણ કરાયેલી રકમ પર ગણતરી કરાયેલ જેમાં IRR અભિગમ અને ઘટતી જતી બાકીનો ઉપયોગ કરાયો છે). Pf સાથે: _____% pf અને વીમા સાથે (પસંદ કરાયો હોય તો): _____%
વિતરણ સમયસૂચિ:	જમીનગીરી ડિપોઝીટ /માર્જિન મની: _____ રિવી રાખવું: _____	વસૂલાતની તારીખ: _____ મિટિંગનો સમય: _____	ફોરવોર્ડનારનો વીમા: _____

નોંધ 1: તમને સદરજુ તારીખ અને સમયના રોજ કાર્ડ અને પરત ચૂકવણીના નાણાં સાથે સેન્ટર પર રૂબરૂમાં હાજર રહેવા વિનંતી કરાય છે. તમને પરત ચૂકવણીના પૂરાવારૂપે ચૂકવાયેલી કોઈ પણ રકમ માટે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના સ્ટાફ પાસેથી ફરજિયાત રસીદ લઈ લેવા સલાહ અપાય છે.

નોંધ 2: આ મંજૂરીપત્રમાંની શરતોનો ઉદ્દેશ સુચિત સુવિધા માટેની ચોક્કસ પાયાગત કોમર્શિયલ શરતોનો સારાંશ રજૂ કરવાનો છે. તેનો ઉદ્દેશ સુચિત સુવિધાના સંબંધમાં બેંકની તમામ જરૂરિયાતોની વ્યાખ્યાત્મક યાદી રજૂ કરવાનો નથી. અહીં ઉલ્લેખિત વ્યાજદરો, ચાર્જિસ તથા ફી સમયાંતરે ફેરફારને આધિન છે. આ મંજૂરીપત્ર, લોનકરારમાં નિર્ધારિત નિયમો અને શરતો તથા સુવિધા અને અન્ય સેવાઓ સંબંધિત અન્ય તમામ નિયમો અને શરતોને www.janabank.com ("વેબસાઈટ") પર જાણવેનાર અને ગેરન્ટરને સમજાવે તે બાપામાં અપલોડ કરી દેવાઈ છે. જાણવેનાર અને ગેરન્ટર આ સાથે સંમત થાય છે કે વેબસાઈટ પર મુલાકાત લઈને આવા કોઈ પણ ફેરફારથી પોતાની જાતને અપડેટ રાખવાનું સુનિશ્ચિત કરવાની જવાબદારી જાણવેનાર અને ગેરન્ટરની રહેશે.

નોંધ 3: રિકવરી એજન્ટને રોકવા તેમજ તકરાર નિવારણ તંત્રને લગતી માહિતી મેળવવા લોન કરારમાં 15(a), (b) અને (c) વાંચી જવ.

નોંધ 4: ત્રણ અન્ય RE(s) અથવા સિક્યુરિટીકરણ માટે ટ્રાન્સફર થવા માટે સંબંધિત હોઈ શકે છે.

જાણવેનારા દ્વારા સ્વીકારાયેલું:

નામ: _____
તારીખ: _____
સહી/ અંગૂઠાનું નિશાન: _____

ગેરન્ટર દ્વારા સ્વીકારાયેલું

(લોન કરારના પરિશિષ્ટ 1માં નિર્ધારિત કરાયા મુજબ)

નામ: _____
તારીખ: _____
સહી/ અંગૂઠાનું નિશાન: _____

હસ્તાક્ષર/અંગૂઠો જાણવેનારનો

ગેરન્ટર: